



વિશ્વ
સ્કિઝોફ્રેનિયા દિવસ
૨૪ મે



સ્કિઝોફ્રેનિયામાં

વધુ સારી સંભાળ માટે સૂચનો



**સ્કિઝોફ્રેનિયા વિશે પોતે
માહિતગાર બનો**

માહિતી મેળવવાથી દર્દીઓને વધુ સારી રીતે સમજવામાં અને તેમની વધુ સારી રીતે સંભાળ લેવામાં મદદ મળે છે.




તણાવ ઘટાડો

તણાવથી ઉત્તેજના / આક્રમકતા / આત્મહત્યાના વિચારો આવી શકે છે.



દર્દીઓને સશક્ત બનાવો

દર્દીઓને સ્વતંત્ર રીતે કંઈપણ કામ કરવા માટે પ્રોત્સાહન આપો. તેમને સહકાર આપો અને સશક્ત બનાવો.



દવાની દેખરેખ રાખો

રોગ ફરીથી ન થાય અને વધુ સારી સ્થિતિમાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દવાની કાળજીપૂર્વક દેખરેખ રાખો.



**નશીલા પદાર્થોનું સેવન
છુપાવશો નહીં**

નશીલા પદાર્થોનું સેવન સારવારના પરિણામને ખરાબ / અવ્યવસ્થિત કરી શકે છે. જો દર્દીને નશીલા પદાર્થોના સેવનની સમસ્યા હોય તો તમારા ડોક્ટરને જાણ કરો.



**સ્થિત બગડવાના સંકેતો પર
ધ્યાન રાખો**

જો તમને દર્દીની સ્થિતિમાં કોઈપણ પ્રકારના ફરી થવાના સંકેતો દેખાય તો તુરંત નિયંત્રિત કરવા માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

જાગૃતિ પાર્ટનર:

ALECTA **INTAS**
A Division of INTAS

ઉત્પાદક:

Skizoril
Clozapine 25/50/100/200 mg Tabs.

Skizoril MD
Clozapine Orodispersible Tablets 25/50/100/200 mg